

સંતુલિત આહાર - વાર્તા (૭.૩.૧ અને ૭.૪.૧)

હેતુ: તંદુરસ્ત શરીર માટે પોષ્ટીક આહારનું મહત્વ

પોષ્ટીક આહાર - પોષ્ટીક શરીર બનાવે

એક વખતની વાત છે જ્યારે આપણા ગામમાં છોકરા-છોકરી વરચે મા-બાપ, શું આખું ગામ બેદ-ભાવ કરતાં હતાં આજે પણ છે પણ ઓછું થઈ ગયું છે. ત્યારે સુમિત્રા નામની બેન ના ર બાળક હતા, એક છોકરો (નાનો હતો) એનું નામ મોહન અને બીજી છોકરી (મોટી) એનું નામ હંસા હતું.

સુમિત્રાબેન દરરોજ છોકરાને સારુ અને પહેલાં ખાવાનું આપી દેતા હતાં અને વધે તે છોકરી (હંસા) ને આપતા હતા. ખાવાનું ના વધે તો એ (દિકરી) ભૂજ્યા પેટે ઉધી જતી. ઘરનું આખું કામ (વાસણ, કપડા, ઘરની સફાઈ) બદ્યું હંસા કરતી હતી અને ખાવા મળે તો મળે નહીં તો ભગવાન ભરોસે.

એક દિવસ છોકરી (હંસા) માંટી પડી તો પણ સુમિત્રાબેન (માં) એને ડોક્ટર પાસે નહીં લઈ જતા હતાં અને ખાવામાં (જમવામાં) પણ પોષ્ટીક આહાર નહૃતા આપતા.

એક દિવસ હંસા (દિકરી) ચક્કર ખઈને પડી ગઈ ત્યારે સુમિત્રા બેન ઘબરાઈને ડોક્ટર ને બોલાવ્યા. ડોક્ટર દૌડતા સુમિત્રાબેન ના ઘરે આવે છે અને હંસાની હાલત જોઈને તેને તાત્કાલીક દવાખાનામાં ભરતી કરાવાનું કહે છે, નહીં તો..... સુમિત્રાબેન ઘબરાઈ જાય છે અને દવાખાનામાં હંસાને ભરતી કરાવે છે. સુમિત્રાબેન ઘબરાઈને રકવા લાગે છે કે હવે મારી દીકરીનું શું થશે? ભગવાનને પ્રાર્થના કરે છે કે મારી દીકરીને બચાવી લો, સારી કરી દો.

ડૉ. બેન સુમિત્રાબેન ને કહે છે કે હંસાની તબીયત બહુ નાજુક છે એના શરીરમાં લોહીની કમી થઈ ગઈ છે, એને પોષ્ટીક અને સંતુલિત આહાર નહીં મળવાથી હંસાનું જરૂર કામ નથી કરતું. તમારી દિકરીની પાચનશક્તિ પણ ખરાબ થઈ ગઈ છે. હું આગળ તમને શું કહુ અંદરના જે મહત્વપૂર્ણ થંગ્રો (Organs) છે એ બધા ખરાબ થંડ્યા ગયા છે અને હવે હંસા ને દવાખાનામાં જરાખવી પડશે. જ્યાં સુધી હંસાની તબીયત સારી નહીં થાય ત્યા સુધી.

સુમિત્રાબેન રકીને કહે છે કે ડૉ. બેન આ મારી ભુલ હતી કે હું એની પાસે ઘરનું બદ્યું કામ કરાવતી હતી અને ખાવામાં સંતુલિત અને પોષ્ટીક આહાર ન હતી આપતી એના લીધે એની આવી હાલત થઈ એના માટે ડૉ. બેન મને માફ કરી દો.

ડોક્ટર બેન કહે છે આ માફી તો તમારે હંસા પાસે માંગવી પડશે. હું તો તમને પોષ્ટીક આહાર આપવાની સલાહ આપીશ, જેથી હંસા જલદી હરી ફરી શકે. સુમિત્રાબેન માની જાય છે અને કહે છે કે

ડૉક્ટરબેન મને બતાવો કે પોષ્ટીક અને સંતુલીત આહાર માં શું શું આવે છે. ડૉક્ટરબેન સુમિત્રાબેન ને સમજાવે છે કે દિવસમાં આમ તો થોડું ખાવાનું પણ ત્રણ વાર સંતુલિત આહાર લેવાનો. સવારે ચા/દુધ ની સાથે (૨-૪ બિસ્કિટ/રોટલી) લેવાની પણી બપોરે જમવામાં દાળ, શાક, રોટલી અને ભાત બહુ જરૂરી છે (સંતુલીત આહાર માટે) અને પાણી વધુ જરૂરીયાત છે જે પાચનશક્તિ વધારવા મદદ રૂપ થાય. પાણી તો આમ દિવસ ૨.૮ - ૧.૩ લિટર અનુમાન ના પ્રમાણે પિવાનું, દાળ થી પ્રોટીન મળે જે આપણાં શરીરના વિકાસ માટે જરૂરી હોય છે. શાકમાં - મિનિરલ્સ, ફોસ્ફોરસ, ભાતમાં - ક્ષાર (કોબોટિટ આહાર), રોટલીમાં - પ્રોટીન, કેલેરી હોય છે.

આ તમે દર્શાજ જમો તો તમારું શરીર સારુ રહે અને એક વાત કે દિકરા અને દિકરીમાં બેદ-ભાવ કર્યા વગર એમને પોષ્ટીક આહાર ખવડાઓ, તો શરીર પણ તંદુરસ્ત રહ્યો અને દવાખાનાનું અને ડૉક્ટર નો ખર્ચો પણ બચી જશે. ‘સંતુલિત શરીરમાટે સંતુલિત આહાર ખુબજ મહત્વનો છે’.


આપણું શરીર (૭.૩.૧)

- આપણા શરીરમાં પાણીનું મહત્વ ધાણું છે.
- ૨.૮ - ૧.૩ લિટર પાણી પીવું જોઈએ.
- જીવન / જીવન માટે પાણી બહુ જરૂરી છે.
- આપણા શરીરમાં ૨/૩ (બે-ગૃતિયાંશ) ભાગ પાણીનું છે.
- ઘેઝાનિકો કહે છે અને માને છે કે જીવન (જીવ) પાણીથી જ શરૂ થયું છે.
- મરધીના બરચામાં ૨/૪ (બે ચર્ટુથાંશ) ભાગ પાણી હોય છે.
- અનાનસમાં ૨/૫ (બે પંચઅંશ) ભાગ પાણીનું હોય છે.
- ઘેઝાનિકોના પ્રમાણે આ જીવન ૧૮૦૦ મિલીલિટર વર્ષ પહેલા થયું હતું (સાગર અને સમુંદર માંથી) (આ ઘરતી / પૃથ્વી પર ૮૭% (સંતાળું) પાણી પીવાલાયક નથી ફક્ત ૩% જ પાણી પીવાલાયક છે)

પાણી (૧૦.૩.૪)

હેતુ: પાણીનું મહત્વ સમજાવો:

પાણી - પાણીરે
 બધામાટે પાણી
 નિલા, મિના, રિના માટે પાણી
 સુરજ, નિરજ, કિરણ, માટે પાણી
 જીવવામાટે પાણી
 પિવામાટે પાણી
 હાથ, પગ ઘોવામાટે પાણી
 નાહવામાટે પાણી
 પાણી - પાણીરે
 ચકલી, કોચલ, કાગડા, કબુતરોમાટે પાણી
 કુતરા, બિલાડી, ગાય, ભેંસ માટે પાણી
 જીવવામાટે પાણી
 ખેતી માટે પાણી
 ઉધોગ માટે પાણી
 ઝાડને લહરતા જોવા માટે પાણી
 બગીચામાં ફૂલને ખીલાવા માટે પાણી
 પાણી - પાણીરે
 નળમાં પાણી, ઘરમાં પાણી, કુવામાં પાણી
 નંદી અને સાગરમાં પાણી
 પાણી વગર બધું ખાલી
 પાણી વગર બધા દુઃખી
 પાણી વગર બધા નિરસ
 પાણી વગર જીવન દુષ્ટાધારી
 પાણી પાણીરે..



શેલ પ્લે: પાણીનું મહત્વ (૧૦.૩.૫)

- મિના : મમ્મી પાણી આવ્યું, નળ ખુલ્લો છે.
 મમ્મી : (મમ્મી રસોઈમાં છે અને બોલે છે) આવા દે નળને ખુલ્લો જ રાખ (પાણીનું વ્યય થાય છે)
 મિના : મમ્મી નળ બંધ કરું
 મમ્મી : ના।

- મિના : (૧૫મિનિટપછી) મમ્મી હવે નળ બંધ કરું ?
- મમ્મી : એમ કરતુનાહિલે
- મિના : પણ હું બે (૨) વખત નાહીલી છું
- મમ્મી : તો પણ
- મિના : (નાહવા બેસી જાય છે)
- મિના : મેં નાહીલી દ્વારા
- મમ્મી : માટલાનું પાણી રેડી એ અને ટેગડાનું પાણી બધુરેડી એ
- મિના : મમ્મી આ પાણી તો સવારે જ ભર્યું હતું ને ?
- મમ્મી : હા, દિકરી પણ હમણાં તાજુ પાણી આવે છે એટલા માટે
 (જથારે મિનાની મમ્મી પાણી ભરતી હતી અચાનક નળ નું પાણી જાય છે)
- મિના : મમ્મી પાણી તો ગયું
- મમ્મી : ચાલશો, આજે તો ચાલી જશો એટલું પાણી છે અને કાલે સવારે તો પાણી આવવાનું જ
 છે. (બીજા દિવસે પાણી નથી આવતું, મમ્મી મુશ્કલીમાં અને ચિંતા માં આવી જાય
 છે.)
- મિના : મમ્મી આજે પાણી નથી આવવાનું ?
- મમ્મી : ખબર નહીં સાંજ થવા આવી અને પાણી નથી આવ્યું દિકરી
- મમ્મી : જા તો દિકરી હંસાબેન ને ત્યાં પુછી આવ
- મિના : (ધોળીને જાય છે) મમ્મી ત્યાં તો સુરજ નાહવા બેસ્યો છે.
- મમ્મી : હંસા બેન ઓ હંસાબેન તમારે ત્યાં પાણી આવ્યું
- હંસાબેન : ના નથી આવ્યું
- મમ્મી : પણ મિના એ કિંદું કે સુરજ તો નાહવા બેઠો છે.
- હંસાબેન : હાં, કાલનું આખું પાણી ભરેલું છે ને કેમ તમારે ઘરે પાણી નથી કાલે તો બહુ બધુ પાણી
 આવ્યું હતું ને
- મમ્મી : હાં પણ મેં સાંજે રેડી ટિંદું હતું.
- હંસાબેન : તમે મારા ઘેરથી પિવાનું પાણી (૧ ડોલ) લઈ લો.
- મમ્મી : કાલે આવશે
- હંસાબેન : ખબર નહીં આવવું તો જોઈએ.
 (ગીજા દિવસે પાણી આવે છે)
- મમ્મી : મિના નળ ખુલ્લો છે. પહેલા નળ બંધ કરી એ. (મમ્મી બાથરુમમાંથી) હું નિકળી પાણી
 ભરીશ.
- (પાણી કહે સમજો મારી વાળી હું જ તમારું જીવન તોચ અમથું ધોળો પાણી મને બચાવો
 તમને હું બચાવીશ, હું તો મારી આ વાત તમને સમજાવી ?)

હવા (૧૦.૩.૨)

હેતુઃ જ્યારે હવા ન હોય ત્યારે સજીવને કેવું લાગે અને કેવું વિચારે

આવ હવા (૨)

તુકણીયા રોકાયલી છે

આવતી કેમ નથી ?

તારા વગર અમને બધાને રમવા ગમતું નથી

આવ હવા....

અમારા શરીર પરસેવેથી લત પત થઈ ગયા છે

કપડા પણ પલડી ગયા છે

આવ હવા....

અમારા શરીર માંથી વાસ આવે છે

પ્રાણીયો બોલતા નથી

પદ્ધીઓ ગાતા નથી

અમે રમતા નથી

જાડ લહરાતા નથી (જુમતા નથી)

જુમી (૨) ને આવ, થોડુક ઈતરાવીને આવ

આવ (૨) હવા આવ, આવીને બધા સજીવમાં ભાન લાવ

તારી સુગંધ થી બધા ખુશહાલી ને મહકાવ અને આ ધરતી પર ખુશહાલી લાવ. આવ હવા આવ....

Appendix - III (D)

ધરતી /પૃથ્વી (૧૦.૪.૬)

- ❖ ધૂળ (પદાર્થ) એક બીજા સાથે મળી ને એક નાનો આકાર પડયો (Condensed form) / ધૂળ એક બીજા સાથે ચોટી ગઈ અને એક ગોળ આકાર બન્યો અને ગુરુત્વાકર્ષણ બળ ને કારણે આ શક્ય બન્યું અને આવી જ રીતે મોટા-મોટા પદાર્થ બન્યા (બહુ બધી ધૂળ ભેગી થઈને ધરતી (સૂર્યની ફરતે ફરતો ત્રહ) અને બીજા ત્રહોની રચના થઈ).
- ❖ આ પદાર્થનો ના ઘટક / ભાગ જુદા પડવા લાગ્યા (સડવું) એમાં થી ઉર્જા ઉત્પન્ન થઈ અને આ પૃથ્વીના અંદરની વસ્તુઓને ગરમ કરી અને ધાતુઓને પિગાળવા લાગ્યા.
- ❖ ૧૦ લાખ હજાર વર્ષ પછી આ ધરતી ઠંડી પડી (ધરતીનો ભાગ) અને એક પદ્થરનો આકાર લીધો અને પછી આ પૃથ્વીનું ઉપ્પરના ભાગ/પડ ઠંડું પડ્યું અને પહેલો વરસાદ પડયો. આ વરસાદ સૌ વર્ષ (શતાબ્દી) સુધી પડયો.
- ❖ ધીમે રહીને આ મોટા (ધન / કઠળા) પદ્થરો પીગળ્યા અને આમાંથી રસાયણિક વસ્તુઓ પણ પીગળી ગઈ.
- ❖ આ પછી વરસાદ ના કારણે ગંદુપાણી એક જગ્યાએ એકહું થયુ અને ખાબહું બન્યું પછી સરોવર બન્યું અને પછી મહાસાગર બન્યા અને આમાં જે પાણી હતું એમાં રસાયણિક પદાર્થ હતાં જે જીવન માટે જરૂરી હોય છે.
- ❖ સૌથી મહત્વના હાયડ્રોજન, કાર્బન, નાયટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફોરસ અને સલ્ફર છે.

Appendix - III (E)

હવામાન (૧૦.૪.૫)

આઈસ દવારા જુદી જુદી ઋતુઓ વિશેની માહિતી બાળકોને આપી શકાય છે. દરેક ઋતુની વિશેષતા, પોશાક, ખોરાક, માનવ-જીવન પર તેની અસર વગેરે વિશેની માહિતી બાળકોને આપી શકાય છે.

ડા.ત.

૧. શિયાળો

- બાળકોને શિયાળામાં કેવાકપડા પહેરવા જોઈએ તેની માહિતી મેળવી શકે છે.
- શિયાળામાં લોકો કેવો ખોરાક ખાય છે. તે વિશે જાણી શકે છે.
- ઠંડી થી બચવા લોકો શો ઉપાય કરે છે. તે વિશે માહિતી મેળવી શકે છે.
- કારતક, માગશર, પોષ, મહા ચાર મહિના શિયાળાની ઋતુઓનો અનુભવ થાય છે. તે વિશે જાણી શકે છે. - વ્યાયામ અને કસરતના ફાયદા સમજાવવા.

૨. ઉનાળો

- ફાગણ, ચૈત્ર, પૈશાખ, જેઠ આ ચાર મહિના ઉનાળાની ઋતુનો અનુભવ થાય છે. એ વિશેની માહિતી મેળવી શકે છે.
- આ ઉપરાંત ઉનાળામાં લોકો કેવા કપડાં, ખોરાક, પીળાં, ગરમથી બચવાના ઉપાયો વગેરેની માહિતી મેળવી શકે છે.

૩. ચોમાસું

- ચોમાસામાં લોકો, પ્રાણીઓ, પંખીઓની અને સજીવસૂદ્ધિની પર શી અસર થાય છે, તે વિશેની માહિતી મેળવી શકે છે.
- કેવાકપડાં પહેરે છે. તે જાણી શકે છે.
- પાણીનું મહત્વ વરસાદ વરસવાના ફાયદા પાક વિ. માટે પાણીની ઉપયોગીતા.

પાણીનો સંગ્રહ અને સાચવણી (ધર આંગણે જેતરમાં)

ભારત એ ખેતી પ્રધાન દેશ છે ખેતીનો વિકાસ ત્યારે જ સારો થઈ શકે જયારે તેને પુરતું પાણી મળી રહે. ખેતી જ શા માટે આજે તો તમામ જીવસૃષ્ટિનો આધાર પાણી ઉપર રહેલો છે. રોજુંદા ઉપયોગથી માંડીને ખેતી, ઉધોગો, કારખાના, મિલો, તમામ જગ્યાએ પાણીએ મુખ્ય જરૂરિયાત છે. છેદ્ધા કેટલાય વર્ષોથી વરસાદની અનિયમિતતાને કારણે પાણીની જટિલ સમસ્યાઓ ઉભી થઈ રહી છે અને જો વરસાદ આ જ રીતે અનિયમિત અને અપૂર્ણ રહેશે તો એ દિવસ દુરનથી જયારે પાણી પણ દુધ અને પેટ્રોલના ભાવે મળતું થઈ જશે. આ માટે પાણીનો વિવેકપૂર્ણ અને કરકસરથી ઉપયોગ થાય એ અતિઅધિક બની ગયું છે. આ બાબતને બાળકને તેમના લેવલ પ્રમાણે પાણીનો ઉપયોગ, તેની મહત્વતા, તેની જાળવણી વિશે આ ચિત્રો દ્વારા માહિતી આપી શકાય છે.

- (૧) જળ એ જીવન છે.
- (૨) પાણીનો બગાડ થતો અટકાવો, જીવનમાં સમૃદ્ધિ લાવો.
- (૩) વેકફશો જો પાણી, તો જીવન થશે દુષ્પદાણી
- (૪) પાણી બચાવો - શાણપણ બતાવો.
- (૫) જો પાણી જાય એલે, તો દુષ્કાળ આવે આપ મેળે.
- (૬) જળ અને જમીનનું સંરક્ષણ કરીએ.
- (૭) ભૂગર્ભ જળજેટલું ખેંચીએ તેટલું પાછું આપીએ.
- (૮) ટીપે ટીપે તળાવ ભરાય, તે પાણીને કેમ વેકફાય.
- (૯) વગેરે સૂત્રો બનાવી બાળકોને પાણીના મહત્વ વિશે જાગૃત કરવા.

વરસ્યા મેઘરાજ

દેક્કાભાઈએ દ્રાંઊ કર્યું ત્યાં,
વરસ્યા મેઘરાજ;
નદીઓ ઝરણાં રેલાયાં,
નીલ લૈને ઝાડાં.... દેક્કાભાઈ ...
ચમચમ વીજળી ચમકે,
ઝાડ બન્યાં સૌ તાજાં;
ઘરડ ઘરડ, ઘડામ, ઘડામ,
વગાડે મેઘ વાજાં ... દેક્કાભાઈ ...
ઘરતી ખેડુ સહુ મલકયાં,
પંખી ખાતાં ખાજાં;
વરસાદી આવેળા આવે,
જાણે થતાં સૌ સાજાં દેક્કાભાઈ ...

ચાલો વાવીએ

વાવણીની વેળા આવી,
ચાલો વાવી દઈએ.
અકેકરોપા રોપવા કાજે,
ખુલ્લી જગામાં જઈએ
ખેતર શેઢા, પાદર સીમ,
ખંતથી ખૂંટી લઈએ.
ખાડા ખોઈ ખાતર નાખી.
રોપ રોપી રાજુ થઈએ.
પથિવિરણાના જતન કોજે,
હરિયાળી સધને કરીએ
વૃક્ષ થકીથી વરસાદનો જગમાં,
આવો સંતાપ એ હરીએ.
વાવણીની વેળા આવી,
આવો વૃક્ષો વાવી દઈએ.

આવ્યા વરસાદ

આવ્યો વરસાદભાઈ,
લોને છબછબિયાં.
કાગળની નાવ ભાઈ,
કરો ડબડબિયાં... આવ્યો...
નદીઓમાં નીર જાય,
કરતાં ખળખળિયાં.
વગડો, ખેતર, ગાચ,
ઘરતી કલકલિયાં.... આવ્યો...
આકાશે વીજ થાય,
જબકે જળ જળળિયાં.
મોર મેડક ભાઈ,
પક્ષી સળવળિયાં.... આવ્યો...
ભાગીને કચાંચ ગચાં,
અંખનાં જળજળિયાં.
આનંદ ઊભરાઈ ભાઈ,
સુખ આવી અહીં. મળિયાં... આવ્યો...